

## મા નર્મદા મહોત્સવની સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો

૧. ફક્ત વેબસાઇટ(www.narmadamahotsav.gujarat.gov.in) દ્વારા on line નોંધણી કરેલ સ્પર્ધકો જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધાનું માધ્યમ ગુજરાતી ભાષા રહેશે.
૨. સ્પર્ધા માટે નોંધણી અને એન્ટ્રી, તારીખ: ૧૦/૦૭/૨૦૧૭ થી ૨૫/૦૭/૨૦૧૭ સુધી ખુલ્લી રહેશે.
૩. આ સ્પર્ધા માં નીચે મુજબ ની ત્રણ શ્રેણી રહેશે -
  - અ. ધોરણ ૧૦ સુધી ના વિદ્યાર્થીઓ .
  - બ. ધોરણ ૧૧ થી કોલેજ/ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ .
  - ક. અન્ય નાગરિકો.
૪. વિદ્યાર્થીઓ એ શાળા / કોલેજ નું નામ તથા શાળા / કોલેજ ના શિક્ષક, મુખ્ય શિક્ષક અથવા પ્રિન્સિપાલ નું નામ અને મોબાઇલ નંબર તથા અન્ય સ્પર્ધકોએ પોતાનો મોબાઇલ નંબર આપવો ફરજિયાત છે.

૫. દરેક સ્પર્ધક કોઈ પણ એક અથવા વધારે સ્પર્ધામાં ગમે તેટલી વાર ભાગ લઈ શકશે. સ્પર્ધા ને લગતા દરેક વિષયો સ્પર્ધક નું પોતાનું સર્જન / મૌલિક હોવું જોઈ એ .

૬. આ સ્પર્ધા માં ફક્ત on line entry થી જ નોંધણી કરી સ્પર્ધાને લગતી માહિતી જેવી કે કવિતા, નિબંધ, સ્લોગન , નર્મદા ના પાણી થી થયેલ લાભ ને લગતી સફળ ગાથાઓ અને આશરે એક મિનિટ ની મોબાઇલ ફિલ્મ નીચે દર્શાવ્યા મુજબ ની ફાઇલ ફોર્મટ માં અપલોડ કરવાની રહેશે.

૭. કવિતા, સ્લોગન, સફળ ગાથા અને નિબંધ અપલોડ કરવા માટે word ફાઇલ કે pdf ફાઇલ માં shruti font નોજ ઉપયોગ કરવાનો રહેશે.

૮. મોબાઇલ વિડિયો ની સ્પર્ધા નો વિડિયો અપલોડ કરવા માટે .mp4 અથવા .avi ફાઇલ નો જ ઉપયોગ કરવાનો રહેશે.

૯. વિજેતા સ્પર્ધકો ને દરેક કેટેગરી માં નીચે મુજબ ના ઇનામો દ્વારા સન્માનીત કરવામાં આવશે.

પ્રથમ વિજેતા : રૂપિયા ૨૫,૦૦૦

દ્વિતીય વિજેતા : રૂપિયા ૧૫,૦૦૦

ત્રુતિય વિજેતા : રૂપિયા ૧૦,૦૦૦

૧૦. સ્પર્ધામાં વિજયી સ્પર્ધકો ના નામ બહોળી પ્રસિદ્ધિ થી સમાચાર માધ્યમો દ્વારા કરવા માં આવશે અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.
૧૧. સ્પર્ધકે ભરેલું સ્પર્ધાની નોધણી માં કોઈ પણ જાત ની અધૂરી વિગતો અથવા વિષયને સંબંધિત નહિ હોય તો તેવી એન્ટ્રીઓ રદ થવાને પત્ર થશે.
૧૨. સ્પર્ધામાં આવેલ એન્ટ્રીઓની મૂલ્યાંકન નિષ્ણાત જ્યુરી દ્વારા કરવામાં આવશે.
૧૩. તમામ સ્પર્ધામાં આવેલ એન્ટ્રીઓ ના પરિણામ/ વિજેતા તથા સ્પર્ધકને સ્પર્ધા માથી બાકાત કરવો કે નહી તેના માટે અબાધિત સત્તા સ્પર્ધાની જ્યુરી ની રહેશે.

૧૪. સ્પર્ધા માં વિજેતા થયેલ નિબંધ, કવિતા, સુવાક્યો, અને વિડિયો ફિલ્મના પ્રચાર/ પ્રસાર કરવાના અધિકારો સરકારશ્રીના રહેશે.
૧૫. આ સ્પર્ધાને લગતા કોઈ પણ વાદ વિવાદ માં નિષ્ણાત જયુરી નો નિર્ણય અંતિમ ગણાશે